

મે 10, 2018

બ્રામ્પટનનો સમય આવ્યો છે. વિકાસની અગ્રતાઓ આગળ વધારવામાં મદદરૂપ થાવ.

બ્રામ્પટન, ઓન્ટેરિયો – સીટી ઓફ બ્રામ્પટન શહેરની મહત્વની વિકાસ અગ્રતાઓ: માળખાગત સગવડ, શિક્ષણ અને નવીન શોધ, આરોગ્ય સંભાળ અને પ્રાદેશિક શાસનને આગળ વધારવામાં મદદરૂપ થવા શહેરના પ્રોવિન્સિયલ ચૂંટણી ઉમેદવારોનું ધ્યાન આકર્ષી રહ્યું છે.

વકિલાત વ્યૂહરચનાના ભાગરૂપે, હાલના તાણમાં રાહત મેળવવા અને મહત્વની ભાવિ માગણીઓ સંતોષવા આ શહેરે [મહત્વની અગ્રતાઓ](#)ની વિગતો જાહેર કરી.

મહત્વની અગ્રતાઓ

1. માળખાગત સગવડ:

- ટ્રાન્ઝિટમાં આધારી વૃદ્ધિને પહોંચી વળવા, ચાલુ રહેતી મૂડીની જરૂરિયાત ખાસ કરીને વધારાની બસો, નવી ટેકનોલોજી માટે રહે છે જેથી કરીને અવિરત સુરક્ષા અને કાર્યક્ષમતાની, અને વિકસી રહેલો કાફલો (ફ્લીટ) જાળવવા નવી સંગ્રહણ સગવડની ખાતરી કરી શકાય.
- વધારે હરિયાળી અને વધારે કાયમી શહેરી વિકાસ માટે, રિવરવોક પ્રોજેક્ટ માટે, ડાઉનટાઉન બ્રામ્પટનમાં એટોબીકોક ક્રીક આસપાસ નવીનતમ પૂર સંરક્ષણ યોજના માટે પ્રોવિન્સના રોકાણની જરૂર છે.

2. શિક્ષણ, ઉત્કૃષ્ટતા અને નવીન શોધ

વધતી જતી વિદ્યાર્થી પ્રવેશ માગ પ્રક્રિયા (એનરોલમેન્ટ) સહિત, ડાઉનટાઉન બ્રામ્પટન યુનિવર્સિટી કેમ્પસ માટે અવિરત સહાયતા.

3. આરોગ્ય ભાગીદારીઓ

બ્રામ્પટન સિવિક હોસ્પિટલમાં દર્દીઓની હાલની સંખ્યાને પહોંચી વળવા, પ્રવર્તમાન પીલ મેમોરિયલ સેન્ટરમાં વધારાના તબક્કાઓ માટેની યોજનાઓ ઝડપી બનાવવા, અને બ્રામ્પટનમાં ત્રીજી હોસ્પિટલ માટે તાત્કાલિક રોકાણ.

4. પ્રાદેશિક શાસન

બ્રામ્પટનની વસ્તીનું નિષ્પક્ષપણે અને પૂરતું પ્રતિનિધિત્વ કરવામાં આવતું હોવાની ખાતરી કરવા, રીજીયન ઓફ પીલ કાઉન્સિલમાં આ શહેરને મેયર ઉપરાંત તમામ 10 બ્રામ્પટન કાઉન્સિલરો હોવાની જરૂર પડે છે.

બ્રામ્પટન રહેવાસીઓને પોતાના સમુદાય અંગે વિચારવા અને શહેરને પ્રભાવિત કરતા મુદ્દાઓ માટે વકાલતમાં મદદરૂપ થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ અગ્રતાઓ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે, રહેવાસીઓને આનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે,

[#timeforbrampton](#)

અવતરણો (ક્વોટ્સ):

“બ્રામ્પટનમાં નવી યુનિવર્સિટી અને આપણાં ડાઉનટાઉનનો પુનઃવિકાસ જેવી ઘણી રોમાંચક બાબતો થઈ રહી છે ત્યારે, આપણાં શહેર માટે મારી નોંધપાત્ર ચિંતાઓ આરોગ્ય સંભાળ ભંડોળને લગતી છે. આપણું શહેર બહુ ઝડપથી વિકસી રહ્યું છે અને દુર્ભાગ્યવશ આ ઝડપી વસ્તી વિકાસ આરોગ્ય સંભાળ સેવા ઘટમાં ફાળો આપતું પરિબળ છે. આપણને બ્રામ્પટનનું હાલનું આરોગ્ય સંભાળ તંત્ર (હેલ્થ કેર સિસ્ટમ) નિભાવવા-જાળવવા અને સંચાલન કરવા ઓન્ટેરિયો ગવર્નમેન્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવાનું ઝડપથી થાય તેવી જરૂર છે.”

- મેયર લિન્ડા જેફ્રી (Mayor Linda Jeffrey)

“સૌથી જુવાન અને સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંના એક શહેર તરીકે, બ્રામ્પટનના વિકાસને જાહેર અપેક્ષાઓ સાથે સંતુલિત કરવું એ શહેર માટે ધ્યાન આપવાલાયક મહત્વનું ક્ષેત્ર બની રહે છે. આપણે મહત્વની પહેલોની વક્રિલાત કરવા સરકારના તમામ સ્તરો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું જેનો લાંબા સમય સુધી આર્થિક પ્રભાવ પડશે, નવી નોકરીઓ ઊભી થશે, અને આપણાં રહેવાસીઓ માટે સામુદાયિક ગૌરવ અને જીવનની ગુણવત્તા સુધરશે.”

- હૅરી શ્લેન્જ, (Harry Schlange), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca